https://archive.org/details/bk875/page/n0/mode/1up

1921-02 -KKP 2nd Melavado -Poster (Meeting was later cancelled) (875)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

શ્રી કચ્છ કડવા પાટીદાર સમસ્ત જ્ઞાતિનો મેળાવડો.

શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદ્
મહોત્સવ
૨ જો-

સંવત ૧૯૭૭ ના મહા વદિ

આ પ્રસંગે સમસ્ત પાટીદાર બંધુઆને આગ્રહ પૂર્વક વિનંતી કરવામાં આવે છે કે સાંપ્રત સમયે દરેક પ્રજા પોતાની ઉન્નતિ સારૂ અથાગ ઉદ્યોગ કરી સત્વર આગળ વધે છે. ત્યારે કૃષિ-કર્મ કરનાર આ મહાન જ્ઞાતિ ભરતખંડની સાચી દોલત છે તે કેળવણી રહીત, અજ્ઞાનના મહા અંધકારમાં પડી ગરીબાઈની મહાન પીડા ભોગવે છે.

સભાનો આશય.

ઉપરની સ્થીતિમાંથી મુકત થવાની કેટલાક જ્ઞાતિ હિતચિંતક બંધુઓ આજ બાર વર્ષ થયાં લેખ છાપા ત્યાં સભાઓ ભરી તેના રીપોર્ટો છપાવી અનેક ચર્ચાઓ દ્વારા નિસ્વાર્થપણે સતત પ્રયત્ન કરે છે જેના પરિણામે જ્ઞાતિમાં કંઈક જાગ્રતિ પણ આવી છે. તે બીના સમગ્ર જ્ઞાતિજનોના લક્ષમાં છે. છતાં પણ સુલેહ સંપથી જ્ઞાતિજનોને એક કરવાની ઘણી જરૂર છે. બાળી લગ્ન જેવા નઠારા રીત રીવાજને દુર કરી વૈદિક માર્ગે યોગ્ય ઉમરે લગ્ન કરવાં ત્થાં ખેતી વાડી સુધારવી વગેરે ધાર્મીક નૈતિક અને આર્થિક ઉન્નતિ સાધવાનો આશય છે.

આ પરિષદની ચાલતા વર્ષની સભા જ્ઞાતિના મહાન સમુહના જેવા મધ્યસ્થળે ઉપર જણાવેલી તારીખોએ ભરવામાં આવશે, તે પ્રસંગે દેશના જુદા જુદા વિભાગોમાં વસ્તા જ્ઞાતિ બંધુઓ હાજરી આપશે. જ્ઞાતિ હિતના અગત્યના સ્વાલો હાથ ધરી તે પર અનુભવી વિદ્વાનો ભાષણો આપી અભ્યુદયના સરળ માર્ગો સુચવશે. નઠારા રીત રીવાજોથી થતી ખરાબીના હૃદય ભેદક ખરા બનાવો સંગીતના સાધનો સાથે આખ્યાન રૂપે કહી સંભળાવી શ્રોતાઓને ગંમત સાથે જ્ઞાન મળે તેમ પણ કરવામાં આવશે. આ મહોત્સવ જ્ઞાતિજનોને પર્વ સમાન છે. જેથી પ્રત્યેક જ્ઞાતિજનો આ સભામાં હાજરી આપી સંસ્થાને સંગીન બનાવશો. સભાસદની ટીકીટો પરિષદની આફિસેથી મળશે. સ્ત્રી વર્ગની માટે ખાસ ગોઠવણ કરવામાં આવી છે.

રતનશી ખીમજી ખેતાણી ગામ વીરાણીવાળા.
જનરલ સેક્રેટરી શ્રી ક. પા. પરિષદ હેડ ઑફીસ

જ્ઞાનસાગર લીથો પ્રેસ, ગિરગાંવ મુંબઈ પ્રીં. કે. ગ. જોશી.

realpatidar.com

https://archive.org/details/bk875/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

https://archive.org/details/bk875/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.19 17:37:58 +05'30'

Real Patidar
Unravel Truth

1921-02 -KKP 2nd Melavado -Poster (Meeting was later cancelled) (875)

realpatidar.com

શ્રી કચ્છ કડવા પાટીદાર સમસ્ત જ્ઞાતિનો મેળાવડો.

શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદ્

મહોત્સવ

૨જો-

મહાવિદ = 23-Feb-1921 થી 09-Mar-1921સુંધી છે. See Pirana ni Pol Book - Page 39

સંવત૧૯૭૭ના મહાવિદ

આ પ્રસંગે સમસ્ત પાટીદાર બંધુઆને આગ્રહ પૂર્વક વિનંતી કરવામાં આવેછેકે સાંપ્રત સમયે દરેક પ્રજા પોતાની ઉન્નતિ સારૂ અથાગ ઉદ્યોગ કરી સત્વર આગળવધેછે. ત્યારે કૃષિ-કર્મ કરનાર આ મહાન જ્ઞાતિ ભરતખંડની સાચી દોલત છે તે કેળવણી રહીત અજ્ઞાનના મહા અંધકારમાં પડી ગરીબાઈની મહાન પીડા ભોગવે છે.

સભાનો આશય.

ઉપરની સ્થીતિમાંથી મુક્તથવાની કેટલાક જ્ઞાતિ હિતચિંતક બંધુઓ આજ બારવર્ષ થયાં લેખ છાપા ત્યાં સભાઓ ભરી તેના રીપોર્ટો છપાવી અનેક ચર્ચાઓ દ્વારા નિસ્વાર્થપણે સતત પ્રયત્ન કરે છે જેના પરિણામે જ્ઞાતિમાં કઈક જાગ્રતિપણ આવીછે. તે બીના સમગ્ર જ્ઞાતિજનોના લક્ષમાંછે. છતા પણ સુલેહ સંપથી જ્ઞાતિજનોને એક કરવાની ઘણી જરૂરછે. બાળી લગ્ન જેવા નઠારા રીત રીવાજો દુરકરી વૈદિકમાર્ગે યોગ્ય ઉંમરે લગ્નકરવાં તથાં ખેતી વાડી સુધારવી વગેરે ધાર્મીક નૈતિક અને આર્થિક ઉન્નતિ સાધવાનો આશયછે.

1) Stop Child Marriage
2) Conduct marriage rituals according to Hindu religions (instead of Satpanthi Islaimc religion)
3) Marriages then used to happen, once in 12 years only.

આપરિષદની ચાલતાવર્ષની સભા જ્ઞાતિના મહાન સમુહના જેવા મધ્યસ્થળે ઉપર જણાવેલી તારીખોએ ભરવામાં આવશે, તે પ્રસંગે દેશના જુદાજુદા વિભાગોમાં વસ્તા જ્ઞાતિ બંધુઓ હાજરી આપશે. જ્ઞાતિ હિતના અગત્યના સ્વાલો હાથધરી તે પર અનુભવી વિદ્વાનો ભાષણોં આપી અભ્યુદયના સરળ માર્ગો સુચવશે. નઠારા રીત રીવાજોથી થતી ખરાબીના હૃદય ભેદક ખરા બનાવો સંગીતના સાધનો સાથે આખ્યાન રૂપે કહી સભળાવી શ્રોતાઓને ગંમત સાથે જ્ઞાન મળે. તેમ પણ કરવામાં આવશે. આ મહોત્સવ જ્ઞાતિજનોને પર્વ સમાનછે. જેથી પ્રત્યેક જ્ઞાતિજનો આસભામાં હાજરો આપી સંસ્થાને સંગીન બનાવશો. સભાસદની ટીકીટો પરિષદની આફિસેથી મળશે. સ્ત્રી વર્ગની માટે ખાસ ગોઠવણ કરવામાં આવીછે.

રતનશી ખીમજી ખેતાણી ગામવીરાણીવાળા.
જનરલ સેક્રેટરી શ્રી ક. પા. પરિષદ હેડ ઑફીસ મુંબઈ

જ્ઞાનસાગર લીથો પ્રેસ, ગિરગાંવ મુંબઈ પ્રીં. કે. ગ. જોશી.

realpatidar.com